

## વારંવાર ડોક્ટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ?

--ગુણવંત શાહ

આવતાં દસ-પંદર વખ્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હોસ્પિટલ જશે. ધૂમપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને 'પ્રમોશન' મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે.

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડોક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડોક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મેડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડોક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડોક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વજદાર હોય છે. હંદ્યરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ગુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હંદ્ય મારાથી હારી બેહું? પ્રત્યેક હંદ્યને સ્વમાન હોય છે. માલીક હંદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હંદ્ય બળવો પોકારે છે. હંદ્યરોગ મફતમાં નથી મળતો. એને માટે વખ્ષો સુધી તૈયારી કરવી પડે. હંદ્યરોગ એટલે અપમાનીત હંદ્યનો હાહાકાર! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી.

ડોક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જરૂરી છે : 'સમજનેવાલે સમજ ગયે છે, ના સમજે વી અનાજી છે.'

પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડું હોય છે. ટી.વી. પર કીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને હળવા હળનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓઝીસની ખુરશીમાં કલાકો સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગુહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજૂરાણને દબજાવતી રહે છે. હાહકું નમાવવું જ ન પડે તેવી દીનચર્ચા અને ઘરચર્ચા બલાપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજૂરને હાયાબીટીસ થતો નથી. હાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મોપેડ દોડાવતાં થયાં. નાની વયે હંદ્યરોગ થાય તેની તૈયારીઓ થઈ રહી છે. ઘણાખરા રોગોના મુજમાં પગનો ગૌરવભંગ રહેલો છે.

માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તજેલી વાનગીઓની ભીડ હોય છે. પંજબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરૂ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાકડા ! બીજે દીવસે પેટ બગડે છે. ફાળની લાપસી આઉટ ઓફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અધ્યું કરી નાખે અને ચાવવાનું બમણું કરી નાખે, તો મેડીકલ સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરૂર પુછે : 'વારંવાર ડોક્ટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?' માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધામી'ક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં ધર્મસાધનમું ગણ્યું છે !

ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી.

દીવસમાં એકાદ વખત માણસે હાંફાંતું પડે એવું કોઈ કામ કરતું જોઈએ. ઝડપથી ચાલવામાં કે ધીમેથી દોડવામાં ફેફસાનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા

આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુભંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.

રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે,-એવું કોણ માનશે? નાની મોટી છેતરપોંઠી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે? નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રિકેટનો સ્કોર ગણનારો કે કુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુંબું બોલ્યો? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ઊરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: ‘ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.’ માણસનું વ્યક્તિત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું. ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને ‘પ્રામાણીકતા-ઉપચાર પદ્ધતિ’ કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શક્યતા વધારે છે. આપણી પર્સ્પરામાં આયુર્વેદને ઉપવેદનો દરજા મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહ્યા પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વર્થ આદમીનું લક્ષ્ણ નથી. દ્રેષ રોગજનક છે. ઈષ્ટ રોગજનેતા છે. દગાબાળ કરનાર પોતાના મન પર બહુ મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજજાતત્ત્વ (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેહું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ હચ્ચમચ્ચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્યલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને હોઠીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાળથી મોટું કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં થોહુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.

થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનકીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શક્ય જ નથી. દીનચર્ચાં આપણી સ્વખચર્ચાં (ઉંઘ)ની ગુણવત્તા નકદી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુઝજા કહી છે. કુઝજા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુઝજા કૃષ્ણને શરણે ગાઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કેકેથીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તક્ષાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.

### **:પાદ્યાનો વળ છે:**

મારા હાથમાં અત્યારે જોનાથન ગીન દ્વારા સંપાદિત સુંદર સુવાકયોનું પુસ્તક ‘ધ પેન ડીક્શનરી ઓફ કોન્ટેમ્પરરી કવોટેશન્સ’ છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને ઈદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર જીણાભાઈ નાવીકનું એક વીધાન આવા અંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા જીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:

‘તમારે જીવનું હોય તો ચાલવું જોઈએ;  
તમારે લાંબું જીવનું હોય તો દોહવું જોઈએ.’

--ગુજરાતી શાહ

સંપર્ક: [ટલ્ફોન]: ૧૩૮-વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા-૩૮૦ ૦૨૦

મુંબઈથી પ્રકાશિત રેશનલીસ્ટ માર્સીક ‘વીવેકપંથી’ (તંત્રી : ગુલાબ ભેડા, 2-C/1, Asmita Mogra, Datta Jagdamba Marg, Sher-E-Punjab Colony, Andheri (EAST) Mumbai-400 093 Phone: (022) 2838 8891-સઘળા જુના-નવા અંકો જોવા વેબસાઈટ <http://vivekpanthi.googlepages.com/home> ની મુલાકાત લેવા વીનંતી)માંથી સાભાર..

--ગુજરાતી શાહ

સંપર્ક: [ટલ્ફોન]: ૧૩૮-વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા-૩૮૦ ૦૨૦



### સર્જક-પરીચય

ગુજરાતી વાચકને હવે આ નામનો પરીચય આપવો પડે એવું રહ્યું છે કે? રાંદેર-સુરતમાં ૧૯૭૭માં જન્મેલા આ ‘શાહ’ભાઈ અસ્સલ પટેલ છે. ‘લોકો’ જેને વાંચવા-સાંભળવા ઉત્સુક હોય તેવા માત્ર બે-પાંચ જ લેખકોનાં નામોની યાદી તૈયાર થાય તો તેમાં ગુજરાતી શાહનું નામ આગળ હોવાનું જ. એમનું કોઈ એક જ પુસ્તક પસંદ કરવાનું અમને કોઈ કહે તો અમે એમનું ‘સ્મરણાત્મકથા’ પુસ્તક ‘બીલ્લો ટીલ્લો ટચ’ છાતીએ વળગાડીએ. જો કે પસંદ અપની અપની..બાકી ગુજરાતી શાહને જાણવા-માણવા ઈરછનારને તો એમનું કોઈ પણ પુસ્તક કે એક નાનકડો લેખેય પુરતો થાય. છતાં, ટુક સમયમાં જ જે પુસ્તકની ત્રણ આવૃતીઓ થઈ અને સાઉથ ગુજરાત યુનીવર્સિટીમાં જે એમ.એ.ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે મુકરર થયું તે ‘બીલ્લો ટીલ્લો ટચ’ (પ્રકાશક: આર.આર.શેઠની કંપની, મુંબઈ-૪૦૦ ૦૦૨ અથવા અમદાવાદ-૩૮૦ ૦૦૧) પુસ્તક વાંચવા કર્શાય જોખમ વીના દીલથી ભલામણ કરીએ...

--ઉત્તમ ગજજર (સુરત) અને બળવંત પટેલ (ગાંધીનગર)

‘સન્દેહ-મહેશીલ’ -- વર્ષ: ત્રીજું -- અંક: 146 -- March 23, 2008  
'ઉઝાજોહણી'માં અને 'વીજ્યા' શૈન્ટમાં અક્ષરાંકન: વીજેશ શુક્રલ-vijvan302@gmail.com

13મી જાન્યુઆરી 2006ના દીને મુંબઈ ખાતે ગુજરાતી લેક્સિકોનના થયેલા પ્રથમ લોકપ્રેણને **બે વરસ** પુરાં થયાં. આ બે વરસમાં 7,60,000 જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં <http://www.gujaratilexcon.com> ની મુલાકાત લીધી. આપને અને આપ મારફત આપના મીત્રોને પણ લેક્સિકોનની આ નવી interfaceની મુલાકાત લેવાનું નીમંત્રણ છે. વીચનાં કરોડો ગુજરાતી ભાઈ-બહેનો સુધી આ સંદેશો પહોંચાડવામાં સહાય કરી, આપને પણ ગુજરાતી ભાષાની અમૃત્ય સેવાના પુષ્યના અધીકારી બનવા વીનંતી.


વપરાશકારોના મળેલાં મુલ્યવાન સુચનો અનુસાર અમે <http://www.gujaratilexcon.com> ના ઉદ્ઘાતે પાને જ અમારું 'સરસ ગુજરાતી સ્પેલયોકર' આકૃતી સાથે ડાઉનલોડ લીંક જોડી મુક્યું છે. આપ તે ડાઉનલોડ કરો અને તેની ક્ષમતા ચકાસી સુચનો મોકલો એવી વીનંતી કરીએ છીએ.

આપ સૌના સહયોગ થકી 'સન્ટે ઈ-મહેશ્વિલ'ના 8,200 જેટલા વાચકો થયા અને રોજેરોજ નવાં નામો ઊમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચના રસીયા બહુ મોટી સંખ્યામાં છે.

સૌનો આભાર...અમારી 'સન્ટે ઈ-મહેશ્વિલ'ની અત્યાર સુધીની જુની સઘળી પીડીએફ ફાઈલો અમારી વેબસાઇટ <http://gujaratilexcon.com/index.php?aciton=downloadSeM>

પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકશે. આ જ વેબ સાઇટ પરથી લેક્સિકોન અને શ્રી. વીપુલ કલ્યાણી તરફથી લંડનથી પ્રકાશિત થતા 'ઓપીનીયન' માસીકના કેટલાક નમુનાના અંકની અને શ્રી. પ્રવીણ વાધાણી (મેલ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશિત થતા 'માતૃભાષા' માસીકની મુલાકાતે પણ જઈ શકશે..

### ● મધુરેણ સમાપયેત્ ●



ને વીક પછી તમે પણ ઈન્ડિયા જવાના જ છો..., તો, પછી તમારી સાસુને તમે સાથે લઈ જવાને બદલે અમારો સંગાથ ગોત્તી ને અમારી સાથે કેમ મોકલો છો?

બઈલા..., આવું શું કર્યો છો? અમે તો અરાયાંથી ઉત્તીને સીધા જાત્રાને જવાના છીએ, એમને આ ઊરે બધે લઈને કયાં કયાં ફરવે? તમે પણ ખરા છો!  
અમારી જાત્રા ડાયોણે તમે ક્યાં પાપમાં પડો છો?

*Mahendra*

પેન્સીલવેનીયા-અમેરિકામાં વસેલા અમદાવાદી કાર્ટુનીસ્ટ શ્રી. મહેન્દ્રભાઈ શાહનો

ઈ-મેઈલ સંપર્ક : [mahendraaruna@msn.com](mailto:mahendraaruna@msn.com)

એમનો પરીચય પામવા અને એમનાં ખુબ બધાં કાર્ટુન્સ માઝાવા જુઓ એમની

web site : [www.ameamericanandavadi.com](http://www.ameamericanandavadi.com)

'સન્ટે ઈ-મહેશ્વિલ' -- વર્ષ : ત્રીજું -- અંક : 146 -- March 23, 2008

'ઉઝાજોહણી'માં અને 'વીજ્યા' ક્રીન્ટમાં અક્ષરાંકન : [vijvan302@gmail.com](mailto:vijvan302@gmail.com)

◆◆◆◆◆